

કૃદાની રોશાની

ફક્ત દ્વારા દ્વારા દ્વારા દ્વારા

રદ્દાની રોશાની

[હજરત દ્વારા આકા સુલતાન મુહમુખ મદરાઝના]
અમૃત્ય ફરમાનો

સંપાદક :

મી. મહમદ અલી દ્વારા નાના

“ અલ્યાસી ”

૪૭૪, કૃષ્ણ પીલ્ડિંગ, ઠરીમાધ્યા, ઠરાચી-૩૮.

પ્રકાશક :

દ્વારા દ્વારા દ્વારા દ્વારા દ્વારા

सर्व इच्छ स्वाधीन

आवृति पहेली

१२ भी एकटोयर, १८७२

प्रत : ₹०००

मुद्रण :

गुलको प्रिंटर्स्,

तालपुर रोड, (पुढे स्ट्रीट), छराची-२.

प्रैन : २३६०७२

મરતયા ઈદમ કેરા

સય હુન્નર ઉપર હુએ આલા,
કે ઈદમસે તો રય પહેચાના.

જીને અપના દીલ ઉંઝલા;
આર હુન્નર કમાઈ રેના હેવે

પહેંચાન ખુદાકી રહેવે ઘાકી,
એ સુનો સમજે યાણ રાખો.

ફરમાયા કઉસરે સાકી.
(કલામે ભીલા)

ઇસ્માઈલીએનું એ ગૌરવ છે કે
ઇસ્લામના આરંભથી આજ દિવસ સુધી
રહુની પ્રકાશની દુનિયા ઇમામત સાથે
એક સત્ય તરીકે રહે છે. આ અનોખી
પ્રણાલિકા પ્રમાણે દરેક વખતના ઇમામે
પોતાના મુરીદોને દુનિયાની જવાખદારી-
એને સંસાળવા સાથે પોતાના મકસદને
હુંસલ કરવા ચોગ્ય હિંદાયત ફરમાવે છે

વળી ઈસ્માઇલી મજુહુય એક ઘાતુની
મજુહુય હોઈ તેની આકેયતની દવા તરીકે
ઘાતુની પાકાઈ અને સર્જાઈ ઘતાવવામાં
આવેલ છે.

મજુકુર હિંદાયતોને એક સાથે ૨૩
કરવા આ પ્રકારાન ઘહુાર પાડવામાં આવે
છે બેમાં ઈમામે જુમાનના અમૃદ્ય જીવે-
રાતોઝીપી ફરમાનો સમાવવામાં આવ્યા છે.

આ પ્રકારાન આપણા દીનદારોને એક
બેટ તરીકે આપવા માટે ભી. મહુમદાયલી
ઇન્દ્રાહુમ નાનાલુ “અહ્યાસી” અને
તેમના સાથીદારો અને સખીગૃહુસ્થોને
ધન્યવાદ ઘટે છે.

મૌલા તેમના નેક કામ ઘદ્દાલ તેમના
દિલની નેક ઉમેઢો પુરી કરે, આમીન.

नैराखी, ता. ६-१०-१८०५

હજરત ભૌલાના ધણી સલામત સરકાર
આકા સુલતાન મુહમ્મદશાહ દાતાર ધમામે
કૃમાંયુ કે:-

ઇન્સાન જ્યાં સુધી આ દુનિયામાં
છે, ત્યાં સુધી તે સ્કુલમાં શિખનાર વિધાર્થી
માઝેક છે. સ્કુલમાં શિખતા છોકરા હુમેશાં
પોતાનો અહૃયાસ ચાલુ રાખે છે અને
સ્કુલમાં જે શિખવવામાં આવે છે તેનું
શિક્ષણ દ્યે છે: તેમજ ઇન્સાન આ દુનિ-
યામાં જીવે ત્યાં સુધી શિખતાં શિખતાં

હાશિયાર, અક્ષલવાન, ધદમી તથા હિંમત-
વાન થાય છે.

જે છોકરે નાનપણુથી સુસ્તી કરીને
પોતાનો પાડ ઘરેઘર યાદ કરતો નથી,
તે પરિક્ષામાં પાસ થતો નથી અને ગધેડા
મિસાલ રહ્યી જાય છે.

ઇન્સાન હુમેશા શિક્ષણ લેતો રહે તો,
ગુજરી ગયા બાદ આખરતની પરિક્ષામાં
પાસ થાય.

દુનિયામાં કયા કયા પાડ શિખવા
નોધાયે? પહેલો પાડ તો પાકાઈનો પાડ
છે; એટલે સર્વે બાધતોમાં પાક અને સાંકુ

થવું. જે આ પાકાઈનો પાડુ દુનિયામાં
ખરાઘર શિખ્યા હશો, તો ઈન્શાઅદલાહુ
મરણું ઘાટ જ્યારે તમારી પરિક્ષા લેવામાં
આવશે ત્યારે પાસ થશો.

મરી ગયા ઘાટ આખરતની પરિક્ષા
પાસ કરવા માટે ચાર પાડુ કરવાની
જરૂર છે. આ ચાર પાડુ આ પ્રમાણેના છે.

(૧) તમારું ઈમાન પાક બેઇએ.

(૨) તમારા આમાલ પાક બેઇએ.

(૩) તમારી આંઘ પાક બેઇએ.

(૪) તમારા હૃથ પાક બેઇએ.

(૧) હવે ઈમાન એવી રીતે પાક હોવું
બેદિયે કે, તમારે ઇહ અક્ષલ અને ઈશ્ક
વડે પાક હોય, ત્યારે તમારું ઈમાન પાક
થયું કહેવાય. જે ઈમાન પાક થાય તો,
પહેલા પાઠમાં તમે પાસ થયા, એમ
કહેવાય. ઈમાનનો પાયો ઈશ્ક ઉપર રહેલો
છે. જે ઈશ્ક ખરાખર હોય તો, ઈમાન ઇહ
સાથે એકજ થઈ જય છે.

(૨) આમાલ પાક તે શું? અને તે
કેવી રીતે પાક રહે? આમાલ પાક રહેવા
માટે હુમેશા યાદગીરી રાખવી બેદિયે.
આ યાદગીરી રાખવાનું કામ ધારું કરુણ
છે; કારણ કે શોતાન ઈન્સાનને હુમેશાં ફરેય

આપે છે. શોતાન રાત દિવસ તમારી પાસે
તૈથારજ ખેડો છે. ઇકત હુકીકતી મોમનજ
તેના ફરેખ્યથી ઘચે છે.

નેમ એક ભાગુસ જ્યારે ભુસાઇરી
કરતો હોય છે અને તેની પાસે ભાલ હોય
છે, ત્યારે તે ભાલ લુંટાઈ ન જય માટે,
તે ભુસાઇરને ઉંઘ પણ આવતી નથી;<
કારણ કે તે સમજે છે કે ને હું ઉંધી
જઈશ તો ચોર આવીને ભારે ભાલ લુંટી
લેશો. એટલુંજ નહિ પણ કદાચ મને ભારી
પણ નાખશો, આવી રીતે હુકીકતી મોમન
રાત અને દિવસ એવા જ્યાલ રાખે છે કે
ભારા આમાલ પાક રહે તો સારું અને

મને શેતાન ઘાણ ન આપે તો સારુ.
 આવી રીતે હુકીકતી મેમન શેતાનથી
 કરતા રહે છે, શેતાનને પોતાનો દુશ્મન
 સમજે છે.

(3-૪) તમારી આંખો, હાથ અને
 જીવાન પણ હુંમેશા પાક રહેવા જોઈએ.
 એ ધનસાનની આંખ પાક નહિ હોય તેને
 માટા ગુનહુા છે. આંખો પાક રાખવાનું
 કામ ઘડુજ મુશ્કેલ છે. પરાઇ ઔરત
 અથવા પરાયા માલ ઉપર ઘણજર કરશો
 તા તેમાં તમેને ગુનહુા છે. પરાયા માલ
 અથવા પરાઇ ઔરત માટે તમારા દિલમાં
 જો જરા પણ ઘણજ્યાલ આવશે તો પણ

તમારા હુકમાં ઘણું નુકસાન છે. એ
કામમાં દિનસાનનું માંસ ખાવા જેટલો
જ્યુન ગુનહુા થાય છે. જેએની આંખો
પાક છે, તેએને માટે આસાન છે. તેએથી
કંઈ પણ ગુનહુા નહિ થઈ શકે.

જે માળસની જ્યાન, હાથ તથા પગ
પાક નથી, તેને માટે ઘણું મુશ્કીલ છે.
જ્યાન પાક રાખવાની ભતલઘ એ છે કે,
કોઈ પણ વખત કોઈ મોભન કે ખીણની
ગીયત અથવા ઘણોઈ કરવી નહિ.
આવી રીતે તમારી જ્યાન પાક રાખો.
કદાચ કોઈ મોભનમાં કોઈ જતનો એય
માલમ પડે તો, તેનો ધન્યાંશ કરીને તમારી

જ્યાનથી તનો એય ખોલવો નહિ. કોઈ
પણ ભાગુસ અથવા મોમનનો ઇન્સાક
કરવો એ તમારું કામ નથી.

ખુદાવંદતાલા પણ ભાગુસોના એય
ઉપર પડ્યો હાંકે છે, ત્યારે તમારે પણ
પોતાની જ્યાનથી કોઈનો એય ખુલ્યો
કરવો નહિ જોઈએ. આવી રીતે તમારી
જ્યાન પાક રાખો. તમારા હૃથને ઘરાય
કામ કરવાથી અટકાવો. આવી રીતે તમારે
દરેક કામમાં પાક થવું જોઈએ.

પોતાના ઘરચાંને નાનપણુથી સારા
કામ કરવાની આદત પાડવી જોઈએ; તે

એવી રીતે જે ઘોડેસવાર જયારે ઘોડા
 ઉપર સવાર થાય છે ત્યારે લગામ હુથમાં
 રાખે છે અને જે ખાળુંએ ઘોડાને પ્રેરવવા
 માંગતો હોય, તે ખાળુંએ પ્રેરવે છે. તેવી
 રીતે દૃષ્ટિસાન પોતાના નહેસનો મુખત્યાર
 છે. ભાટે જે રસ્તે તને લઈ જવા માંગો
 તે રસ્તે લઈ જઈ શકે છે. નહેસ ભાથે
 તમે સવાર નહિ થશો અને તમારા દિલને
 ગુનહુાના કામથી નહિ આટકાવો તો, શોતાન
 તમારો મુખત્યાર શઈ જશો અને તમારા
 દિલને પાપના કામ કરવા લલચાવશો.
 શોતાન તમને ગુલામ ઘુનાવશો. શોતાનને
 જે તમારા દિલમાં જગ્યા આપશો તો તે

તમારા ઉપર સવાર થશે.

તમારા ઘરચાંને નાનપણુથી એવી આદત પડો કે તેઓ શેતાનને તાણે ન થાય અને ઘરાઘ કામ કરતાં અટકે. જે માણસના કર્તવ્ય દુષ્ટ હોય, તેનાથી તમે દુર રહેણે. જેમ એક મુસાફર માલ સાથે મુસાફરી કરતો હોય, તે ચોરથી ડરે છે અને ચેતીને ચાલે છે, તેમ તમે પણ શેતાનથી ડરીને દુર રહેણે.

ઇતસાનના ઘણનમાં રહુ છે. તને જેવી આદત આપશો. તેવી પડશો, જેમ માણસ ઘણનની કસરત કરે છે, ત્યારે કસરતઘાજ કહેવાય છે. તે કસરતઘાજ થવા સરં

નાનપણુથી પોતાના શરીરને ઘણ્ણી ઘણ્ણી
 રીતે દુઃખ આપે છે અને એવી રીતે
 આસ્તે આસ્તે કસરત ફરવાની આદત
 પાડે છે. પોતાના શરીરને જુદી જુદી
 રીતે વાળવાની ટેવ પાડવા સાર્થક તે દુઃખ
 સહુન કરે છે; જ્યારે તને ઘરાઘર આદત
 પડી જય છે ત્યારે ઘણ્ણી સહેલાઈથી
 કસરત કરી શકે છે. આખરે તેનામાં
 એટલી ઘણ્ણી કુબ્બત આવે છે કે ઇપિયાના
 સિક્કાને હુથથી દુક્કે દુક્કડા કરી શકે છે.

તમારા રહુ વિષે પણ એમજ છે.
 તમારા રહુને પણ એવી આદત આપો કે
 તે હુમેશા ખુખીના સારા કામો કરે. જ્યારે

રહુને સવાયના કામો કરવાની આદત થશે
ત્યારે તમારો રહુ પહેલવાન ભિસાલ યધ
જરો અને ફિરસ્તા જેવો ઘની જરો
ઘલકે ફિરસ્તાથી પણ ઉંચી હૃતે
પહોંચશે અને તે પછી તમે પોતે મોળજ
કરી શકશો॥

અમો તમોને દુઓ કરીએ છીએ.
તમે તમારા રહુને એવી કસરત આપો કે
તે મોળજ કરી શકે અને તમે પોતાની
અસ્થિ જાતને એણખી શકો. તમારા
રહુને સારા કામ કરવાની આદત પાડો.
તમે રહુને જેવી આદત આપશો, તેવી
આદત તે પકડી લેશો. તમારા રહુને પાડ

કામ કરવાની આદત આપશો તો આસ્તે
 આસ્તે તમારા ઘણભાંથી હેવાનગતી
 યાને જાનવરપણું નિકળી જશે અને
 આખરે મરણ અગાઉ તમારો રહુ ફ્રિસ્તા
 જેવો થઇ જશે.

જે તમારી આદત દ્વારાઓ અને
 ઘરાય કામ કરવાની હુશે તો તમારામાં
 અને જાનવરમાં શું ફરક છે? જે એવા
 ઘરાય કામ કરવાની તમારી આદત થશે
 તો તમારું દિલ આસ્તે આસ્તે સિંહ વિગેરે
 જંગલી જાનવર જેવું થઇ જશે. આનો
 ખુલાસો એ છે કે, વાધ તથા ખીજ
 માંસાહુારી જાનવરો જેને જુએ છે, તેને

પકડીને એકદમ પોતાનો શિકાર કરી લીએ
છે અને તેનું લોહી પી જાય છે, અને
તેનું માંસ ખાઈ જાય છે.

આ પ્રમાણે જે ઈન્સાનનું દિલ પાક
નહિ. હોય અને જનાવર જેવું નાપાક હુશે
તો તે ઈન્સાન પણ વાધની માઝેક પરાયો
માલ અને પરાઈ ઓરતને વાસ્તે ઘરં જ્યાલ
કરશે અને ગુનહૃતા કામ કરશે. ઈન્સાનની
ઘરાય હુલતના સઘઘથી તેનું દિલ પણ
ઘરાય અને હેવાન જેવું થશે, ત્યારે તમો
ઇન્સાન અને હેવાન દરમિયાન શું ઝેરક
ઘાડી રહ્યો?

જે રસ્તેથી ઇન્સાન કિરસ્તો થઇ શકે

છે, તે રસ્તા ઉપર તમે છો, પણ તે
રસ્તામાં ઘણી મુશ્કેલી છે, પણ આદત
પાડવાથી તે રસ્તો ઘણો આસાન થઈ
જાય છે.

તમારે હુમેશાં સારા કામ કરવાની
અને સાચું ખોલવાની આદત પાડવી.
દિન પ્રતિ દિન વધારે વધારે સારા અને
સાચા થવાની કોશિશ કરવી. જે તમે
એવું દૃચ્છતા હો કે અમે હુમણાને હુમણા
સારા ઘની જદુએ તો તેમ ઘની શકવાનું
નથી; કારણકે તમને ઘરાય કામ કરવાની
આદત પડી ગઈ છે.

કોઈ ભાગુસ પાંચ, દશ કે વીસ વર્ષ

સુધી કસરત કરવાની આદત ચાલુ રાખે
ત્યારે તેના હૃથમાં અને શરીરમાં કુષ્ણત
આવે છે. તેમજ જ્યારે તમારા આમાલ
સારા થશો તથા જ્યારે તમારા હૃથ, દિલ
અને દીમાન પાક થશો ત્યારેજ તમે
કુરસ્તા થઈ શકશો.

ઇન્સાન જ્યાં સુધી દુનિયામાં જવતો છે,
ત્યાં સુધી નુરનું પાણી તેના હૃથમાં આવી
શકતું નથી; કારણ કે ખુદા ન ઘાસ્તા
વીસ, ત્રીસ અથવા ચાળીશ વર્ષ
ખાદ તે પાછો ભગડુર ઘની જય અને
ગુનહુના નાપાક આમાલ કરે, તો તે
શેતાન મિસાલ ઘની જય છે.

દાખલા તરીકે જુઓ, અગાઉલ
પોતાની ઘંઢગીથી સાતમા આસમાન સુધી
પહેંચી ગયો પણ ધર્મના મગજને તે
સમજ્યો નહિ. તણે ખુદાનું ઝરમાન નહિ
માન્યું; તેથી શેતાન થઈને જમીન પર
પડ્યો. તમે પણ જ્યાં સુધી દુનિયામાં છો,
ત્યાં સુધી કયારે પણ મગર થરો નહિ.
જરા પણ નાપાકીના કામ કરશો નહિ.

બેભ ડાક્ટર ઘિમાર માણુસની નાડ
તપાસે છે કે, આ દરવીને તાવ છે કે
નહિ? તેજ રીતે તમે પોતેજ ડાક્ટર
થઈને તમારા દિલની નાડ જુઓ. તમે
તપાસ કરો કે મેં એઝરમાનીના કામ

કર્યા છે કે કેમ? માર્ઝિ દિલ કોઈ ઉપર
હુસદ કરે છે કે કેમ? મને ખરાય શોતાની
ખ્યાલ ઉત્પન્ન થાય છે કે કેમ? કોઈની
દુશ્મની કર્ણ છું કે કેમ? કોઈની સાથે
દગલખાળ કર્ણ છું કે કેમ? આવી
રીતે તમારા દિલને તપાસો. જે તમે એવા
કામ કરતા હશો તો તમારો રૂદુ જરૂર
તમને એ વિષે ખાતરી આપશો.

જે તમાર્ઝિ દિલ તમોને ખાર્તી આપે
કે, તમે ગીલા ગીયત કરો છો, કોઈ સાથે
દગાયાળ કરો છો, જુદુ ઘોલો છો, તો
તમારા દિલને એવા ખરાય કામ કરવાથી
દુર રાખજો. જે શાખસ સાથે તમે દગાયાળ

કરી હોય, જેની નીંદા કરી હોય, જેને
 વાસ્તે ખુર્ઝ ઘોધ્યા હો, તે શખ્સ પાસે
 તરત તમે જાઓ. તે શખ્સ જમાતખાનામાં
 અથવા ખીજે કોઈ ટેકાળે હોય, ત્યાં જઈને
 આળજી તથા ખુલ્લા દિલથી, દગ્ગાખાળ,
 દુર્ભની તથા જે પ્રકારનો તેનો ગુનહોંનો તમે
 કર્યો હોય, તે કખુલ કરી તેની પાસે તમે
 માઝી માંગો. સાઝ દિલથી માઝી માંગીને એક
 દિલ કરો અને ત્યાર પછી તેની સાથે તેવો
 ગુનહોંનો કરવો નહિ. આ પ્રમાણે એક ખીજ
 પાસે ગુનહુની માઝી માંગવાની તથા એક દિલી
 કરવાની તમોને આદત થશે તો, તમોને
 કોઈ પણ ઘાયત્રું નુકસાન થશે નહિ.

નેમ કોઈ એક તરી જાળુનાર નહીંમાં
તરતો બાય છે અને નહીના મોળ તેને
બસડીને ખીલુ તરફ લઇ બાય છે, તેને
જે ખાળુંએ જવાનું છે, તેનાથી ઉલ્લિ
દિશામાં પાણીના મોળ તેને લઇ જતા
હોય, તો તે થાડે છેટે સુધી પાણીથી
બસડાઇ જશો, પણ જે તાર હોશિયાર હોય
છે, તો આપરે પાર ઉત્તરી બાય છે.

એજ પ્રમાણે આ દુનિયા દરિયા સમાન
છે. જે ધંસાનનું ધમાન તથા ધર્શક ખરા
હુશો, તો પણ નેમ હોશિયાર તરી
જાળુનારને દરિયાના મોળની મુશ્કેલી નડે
છે, તેમ તેને મુશ્કેલીએ તો આવશેજ,

પરંતુ તે ઉપાયો કરીને સુકી જમીન ઉપર
નીકળી જશો.

તમે તમારો સુકો રસ્તો શોધો. તમારે
સુકે રસ્તે જવું હોય તો, તમારા ઝૂહને
પાક કરો, અને તમારા ઝૂહને દરરોજ
સાચે રસ્તો ચલાવો. આવી રીતે
તમને સુકો રસ્તો હુથ લાગશો. તમારો
સુકો રસ્તો સાતમા આસમાન ઉપર છે.
જ્યારે તમે ત્યાં પહોંચશો ત્યારે સુકી
જમીન તમને મળશો અને તમાડં દિલ
પણ તમને ખાત્રી આપશો. ત્યાં જવા ભાટે
આસાન રસ્તો નથી; ઘણોજ મુશ્કીલ
રસ્તો છે. ત્યાં પહોંચવા ભાટે ચાર ખાખત

પાક હોવી બેધણે. બે તમારી આ ચાર ખાંખ્યતો પાક હુશે તો, તમે ત્યાં જલદી પાડાંચી જશો.

(૧) તમારું ધ્રમાન.

(૨) તમારી આંખું.

(૩) તમારું દિલ.

(૪) તમારા આમાલ.

આ ચાર ખાંખ્યતો પાક રાખવા માટે માનને દુનિયામાં જે રીતે ચાલવાની રહી છે, તેની મિસાલ એ છે કે, બેમ સાદમાં રસ્તા ઉપર ચાલતી વેળાએ રીર ભીંબાઈ ન જાય તેને માટે લાંખો.

કેટ તથા છત્રીથી ઘચાવ કરો છો, જેથી
ઘિમાર ન પડો અને તમારું રારીર
સલામત રહે. જો તમે એવો કેટ ન
પહેરો અને એવી છત્રી ન એઢો તો
વરસાદના પાણીથી તમે ઘિમાર થઈ જાઓ.

તેવીજ રીતે આ દુનિયા રૂપી દરિયામાંથી
સાતમા આસમાનની સુકી જમીનને
પહેંચવા માટે, રસ્તામાં કે સરુક છે, તે પર
શેતાન ઘણી જાતનાં વરસાદ વરસાવે છે.
કિતના, દુર્ભની, જુદું ખોલવું વિગેરે
હિંજારો જાતના વરસાદ તે રસ્તા ઉપર
વરસાવે છે અને મેમનને સુકી જમીન
ઉપર ચડવા નથી આપતો. શેતાન પહેલાં

એ વિચાર કરે છે કે, આ ઈતસાનને જે
 જાતના ગુનહું કરવાની આદત હોય, તે
 પ્રમાણે તે રસ્તે તેને ફરેખ આપું ત્યારે,
 તે જદ્દીથી ભારા તાઘામાં આવી જશે.
 કેદી શાખસને ઘણ નજર કરવાની આદત
 હોય તો, શેતાન તેના ઉપર ઘણનજર
 કરવાનો વરસાદ વરસાવે છે. જેને દ્વિત્તના
 કરવાની આદત હોય, તેને તેવે રસ્તે
 ફરેખ આપે છે. જેને તકઘણુરી અને નીંદા
 કરવાની આદત હશે, તેને તે રસ્તે
 લલચાવશે. આવી રીતે પ્રથમ ઈતસાનને
 તપાસીન શેતાન તેને હળારો રીતે ફરેખ
 આપશે તથા ગીર્ઝતાર કરશે; પણ જેમં

ઇન્સાન વરસાદમાંથી પોતાના શરીરના
રક્ષણ માટે કોઈ પહેરે છે અને છતી એઠાં
છે, તેમ જે ઇન્સાનનું હિલ એટલે રહે
પાક હોય, જેને ગુંડુના કામ કરવાની
આદત ન હોય, તેજ ઇન્સાન શોતાનના
કરેખી વરસાદથી ઘચી શકે છે.

જે કોઈ મોભનની એવી ઇચ્છા હોય
કે, રાત દિવસ ખુદાને રાજ કરું અને
શોતાનને તાણે ન થાઉં તે, તેની પહેલી
કરજ એ છે કે, જે મોભન હોય તેના
હિલને રાજ કરે.

એક માળસનું ધૂમાન ગમે તટલું
મજૂમત રોતો તો પાગ જો તે કોઈ મોભનને

દુઃખ હેશો તા તણે અમને દુઃખ દીધા
ઘરાઘર છે. મોમનને આપેલું દુઃખ
અમારા કલેજમાં ઘાણુંની માર્ક લાગે છે.

અમારા પાક મોમનને અમે અમારી
આંખોમાં રાખીએ છીએ. એવા મોમનને
કોઈ દુઃખ હેશો તા, તણે જણે અમારી
આંખોને દુઃખ આપ્યું.

અમે તમારા પિતા છીએ, તમે અમારા
કુરજું હો છો, ત્યારે વિચાર કરો કે, એવો
કોઈ પણ દીકરો હુશો કે પોતાના પિતાને
દુઃખ હેવા ધરછે? કોઈના એ દિકરા પોત
પોતામાં લડાઈ કરે તા તેનું દુઃખ તેના
પિતાને લાગે છે. આ એક દુનિયાનો

દાખલો છે. દીનના કામમાં પણ એમજ
છે. અમે તમારા રૂહાની પિતાં છીએ અને
દુનિયાના ઘાય કરતાં તમને દશ ગણા
વધારે નજ્ઞક છીએ, માટે કેછ પણ
મોમનને દુઃખ આપશો, તો તે દુઃખ
તમોએ અમને દીધું એમ સમજનો.

જહેરીમાં તમે અમારાથી ઘણા દુર
છો, તથી તમારે કેટલીક ઘાયતોનો ઊર
રાખવાનો છે. અમોએ તમને ફરમાવ્યુ
છ કે, તમે દરિયામાંથી નીકળીને ભીડા
પાણીની નહીમાં આવેલી માછલી જેવા
છો. તમારે બેવડી સંભાળ લેવાની જરૂર
છે. ખુદા ન આસું શેતાન તમારી પાસે

આવીને તમેને ઘાણ આપે, એવું નહિં
 ઘનવા આપતા. તમે એવી રીતે નહિં
 ચાલતા કે શેતાન તમારામાં આતશનો
 વરસાદ વરસાવે. શેતાન આતશનો વરસાદ
 વરસાવે તો તેના ઉપર પાણીની જરૂર
 પડે છે, પાણી ખુદાવંદ પોતે છે.

અમે જહેરીમાં તમારાથી ઘણા દુર
 હોઈએ છીએ. જે તમારામાં શેતાન કંઈ
 પણ કિંતના રૂપી આતશ વરસાવે તો, તેને
 ઘુણવી દેવાને માટે અમારા તાર અથવા
 તાલીકા તમને જલદી પહોંચી શકે તેમ
 નથી, માટે જે તમારામાં કંઈ પણ કિંતનો
 ઉત્પત્ત થાય તો, તમે મહેનત કરીને એક

ખીબમાં એક દિલી કરી, ઝિતનાને દુર
કરનો. ઘનતા સુધી તો લડાઈ ઝિતનો ઉલો
થવા દેશોજ નહિ. એવી રીતે સંલાણીને
તથા ઘણ્ણા કરીને ચાલનો.

તમે જણો છો કે, આદ્રિકમાં કુકુ
કરીને એક જાતનો ખારીક લુવડો થાય
છે, તે પગમાં દાખલ થઈ જાય છે. પહેલાં
તો તેને કાંઈ દરદ થતું નથી પણ તે લોહી
પીને જ્યારે મોટો થાય છે ત્યારે તેને
ઘહાર કાઢવો ઘણ્ણું મુશ્કેલ થઈ પડે છે
અને તેને ઘણ્ણું દુઃખ થાય છે અને
આખરે તે ભાણુસનો પગ સડી જાય છે
અને પગ કાપવા સિવાય ખીનો કોઈ

ઇલાજ રહેતો નથી. જ્યારે પગ કાપી
નાખવામાં આવે છે ત્યારે, દરવીને આરામ
થાય છે. પણ આ કુકુ જેવો પગમાં દાખલ
થાય અને ખુજલી થવા માંડે કે,
સુધીથી અથવા ખીજ કેદ વસ્તુથી તને
કાળી નાખવામાં આવે તો, તે વખતે
સહેલાઈથી ઘરાર નીકળી જાય છે અને
માણુસને કંઈ લુકશાન થતું નથી.

એવીજ રીતે ખુદા ન ખાસ્ત તમારી
જમાતમાં કુકુ પડી જાય, એટલે કે કેદ
પણ જાતનો કિંતનો થઈ પડે તો, તરત
તને અટકાવજો અને જલદીથી એક દીલી
તથા સલાહ કરી લેજો. કિંતના કિસાદને

અહું કાણો; વળી તમારા દિલમાં હસદ
ખીલકુલ નહિ રાખતા. હુસદથી અહું ડરવું
નોઈએ.

ખરાય જ્યાલ તથા ખરાય કામને
તમારા દિલની નજીક પણ નહિ આવવા
દેશો. ખુદા ન ખાસ્ત કોઈ પણ જાતની
ખરાયી થઈ જાય તો જલદીથી તેને
ખલાસ કરી નાખણો; તે એવી રીતે કે,
તમે પોતપોતામાં હેત એખલાસથી
પંજા લઈ, માઝી માંગનીને હુસદને દુર
કરણો.

તમોએ કોઈની નીંદા કરી હોય તો,
તરત તેની રૂઘરામાં જઈ તેના તરફ કરેલો।

૩૨

તમારે ગુન્હા તેની પાસે કખુલ કરને
અને તે ભાડે કરવા માટે તેને આજીજ
કરને. મેમીનની પીછાણું એજ છે. આમ
કરવાથી જરૂર તે ભાડે કરશો.

—૦:—

દારેસ્સલામ, તા. ૨૬-૮-૧૯૬૬

હુઅરત મૌલાના ધણી સલામત સરકાર
આકા સુલતાન મુહુમુદ્રાહુ દાતાર ઈમામે
કૃમાવ્યુ કે :-

તમારા દીનના ઉસુલ (જડ) તે વિશે
કૃમાવીએ છીએ. તમારા દીનનો “ઉસુલે
દીન” શું છે? ઘધા ઈન્સાનનો જ્યાણ
ઉસુલ તથા મગજ ઉપર હોય છે.

તમારામાં કેટલાક એવા છે કે જેમને
પોતાના દીનની કંઈ ઘઘર નથી.

જ્યારે તમે નવરા ખેડા હો. ત્યારે,

તમારે ખ્યાલ કરવો જેઈએ કે, ખાલક
કોણું છે? ભખલુક કોણું છે? તમે એવા
ખ્યાલ કર્યારે પણું કીધા છે? કોઈ તમને
પુછે કે તમે કોણું છો? ત્યારે તમે કહેશો
કે, મારા ઘાપનો દીકરેા; ઘલકે તમારી
થાડીક પેઢી સુધી જવાય આપી શકરો.
જરા વધારે અક્ષલવાળો હુશો તે, આદમ
સુધી પહોંચશો, પછી ઘલાસ.

તમે વિચાર કરો કે આદમ કયાંથી
આવ્યો? આદમને કોણે મોકદ્યો? બે
ઇન્સાન સુઝી હુશો તે આ ખ્યાલને પકડી
લશો.

તમેએ જેયું છે કે, વરસાદ આસ-

આનમાંથી જમીન પર પડે છે, જમીન
 પર પડીને સુકાઈ જાય છે. જે દ્વિપું દ્વિપું
 થઈને નહીમાં ભળો છે અને નહી દરિયામાં
 ભળો છે. સધગું પાણી અંતે પાણું
 દરિયામાં જાય છે. તેજ પ્રમાણે તમારો
 રહુ અસલ છે, તેનું મકાન ધાણગ મોટું
 છે. જે અઝલથી નથી સમજતો અને
 ઉપર જવાની ઉમેદ નથી રાખતો, તે
 જમીન ઉપર પડીને સુકાઈ ગયેલા પાણી
 મિસાલ છે. જેએ ઉપર જવાની ઉમેદ
 ધરાવે છે તેએ ઉપર પહોંચવા માટે
 ઘંઢગી વધારે કરે છે અને મહોઘત પાણું
 વધારે કરે છે.

૩૬

કેદ્યાનામાં ધ્યાદત કરે અને સમજે
કે મરી જશું ત્યારે કેદ્યાનામાંથી છુટા
થઈ ઘેણતમાં જશું; પરંતુ ઘેણત પણ
કેદ્યાનું જ છે.

તમારામાંના જેએ તમારા કરતાં વધારે
અકુલવાળા હુતા, તેએ અમારે રસ્તે
ચાદ્યા છે; મિસાલ મનસુર ચાદ્યો; તેને
વાસ્તે ઘેણત મોળું હતી; પણ તે
કહેતો કે, ખાલી ઘેણતમાં જઈને શું
કરું? જ્યાં સુધી ભગવને ચાખીશ નહિએ
ત્યાં સુધી પાછો નહિએ વળું, આગળ
વધીશ.

જ્યારે અસલની ઘઘર ન પડે, ત્યારે

શું વહ્યું? મુર્ત્જાઅલીએ ફરમાવ્યું છે કે, ‘નેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો’ જ્યાં જેઠે છીએ ત્યાં રહુ-દ્વાસ્તને જેઠે છીએ. જ્યારે તમે માણુસને જુઓ છો, ત્યારે માણુસની શિક્ષણ જેવામાં આવે છે. હૃથ, પગ, મોઢું, આંખો, સર્વો દીઠામાં આવે છે, પણ રહુ દીઠામાં આવતો નથી. તમે રહુને જેવાની તજવીજ કરો.

તમને અત્યારે રહુનો ખ્યાલ છે કે ઘંઢગી કરીને સુખ મેળવવાનો ખ્યાલ છે?

ઇન્સાનનો દરજનો ઉંચ્યા છે, પણ તે પોતાને પોતાના હુથે નીચે પાડી નાંખે છે.

તમારામાંથી કેાઈ કોશિષ કરે કે અમે પીર
સદરદીન, પીર શામસ તથા મનસુર જેવા
થઇએ તો તમે તેવા થઇ શકો છો. તમે
તેનાથી પણ ઉપર થઇ શકો છો.

અમે કહેતા નથી કે તમે કેવા થશો;
પણ અમને ઘધી ઘઘર છે. જે તમે
આપણા દીનના રસ્તા ઉપર મુસ્તકીમ
થઈને ચાલશો તો તમે ઉંચે પહોંચી
શકશો, તેની અમને ઘઘર છે. તમારું
દિલ તથા મકસુદ સુકીમાં હોય તો તમે
પહોંચો. આ ઘાઘતમાં કેટલીક ચીજેની
જરૂર છે, તેમાં ખુલંદ હિંમત જોઇએ. તે
હિંમત તમારામાં નથી. કેટલાક હુનર વધો

થઈ ગયા તેમાં કેટલા માળુસો તે મકસુદને
પહોંચ્યા? ૫૦ ઈસા, ૫૦ રસુલ સી,
મનસુર, પીર શામ્સ અને દુનિયાના ખીજ
થોડા માળુસો પહોંચ્યા છે. તે સર્વેના કામ
તથા રસ્તો એક સરઘાંજ હુતાં. જેએ
ત્યાં પહોંચ્યા તેએ પોતાના રૂહના આરાક
હુતા, રૂહના દોસ્ત હુતા, તેએ તે મકાને
પહોંચ્યા.

દુનિયામાં ઘણું મજહુખ છે, જેએ
સુઝી નથી. શરિયતી નસારા, યહુદી, હિન્દુ
વિગેરે સર્વે મજહુખવાળાએ સુઝી નથી;
તેઓના જ્યાલ તથા ઘંઢગી નીચે જવાની
હોય છે. તેઓ જે ઉમેદ ધરાવે છે, તે

ઉમેદ સારી નથી. તેઓને એ ઉમેદ છે કે,
 ઘેરતમાં જઈ ત્યાં સાર્દ સાર્દ ખાવું,
 સારા લુગડાં, જાજી સ્ત્રોચ્ચો અને
 ઘેરતના સુખ પોતાને ભળે. તેઓની
 આવી ઉમેદો સારી નથી. એવી ઉમેદો
 શરિયતીની છે. ઘેરત પણ દુનિયા માઝુક
 છે. રહુની જે અસલ ઉમેદ છે તે ખીજું
 જવહુર છે.

મૌલાના ઇભી કહી ગયો છે કે, હું
 પ્રથર હતો, તેમાંથી જાડમાં પેદા થયો,
 તેમાંથી ઘદલીને કીડીમાં પેદા થયો, ત્યાર
 ખાદ જાનવરમાં પહોંચયો, જાનવરમાંથી
 ભરીને વાંદરામાં પહોંચયો; તેમાંથી ઈત્સાન

થયો છું, ધર્મસાનમાંથી શું થઈશા? મલાએક ઘનીશા. ત્યાંથી કયાં જઈશા? તે કરતાં ઉંચે જઈશા.

તમે વિચાર કરો કે, ઈના થઈએ. જે કોઈ ચાંડે અને કોરીષ કરે તે ત્યાં પહોંચ્યા શકશે. પણ તમારા ગુનહુા તમને પહોંચયવા આપતા નથી. તે ગુનહુાએ તમને કેદખાનામાં ઘંધ કીધા છે. દુનિયાના ગુનહુાએ તમને કેદખાનામાં નાખેલાં છે. તેમજ ઝાડું ખોલવાની આદતે તમને કેદમાં નાખ્યા છે અને તમારી ઉમેદો જેવી કે, ઘેરેશ્ત, હુરાએ, સારા મેવા, એ સર્વ આરાએ તમને કેદ કરેલા છે; પણ

રહુ કેદખાનામાં કોઈ વખત ખુશી નથી.
જુઓ વિચાર કરે, કોઈ ખુલખુલ અથવા
ખીલ પક્ષીને પક્ષીને પાંજરામાં નાખવામાં
આવે, તેને પાણી અને જે સારી સારી
ચીને જાનવરે ઘાય છે તે આપવામાં
આવે, તા પણું પક્ષી પાંજરામાં ખુશી
નથી. તે ઉદ્દીને હવામાં જવાને વધારે
રાણ હોય છે. તેને પાંજરામાંથી ઉડી
જવાનું મન થાય છે.

પક્ષીની પાંખો કાપીને પાંજરામાં
રાખવામાં આવે અને પછી આસ્તે આસ્તે
તેને પાંજરાની આદત આપવામાં આવે.
પહેલાં તા તેનું મન થશે કે, પાંજરામાંથી

ઘરાર નીકળી જઉં. પણ તની પાંખો
કાચ્યા ઘાંડ એ ત્રણ વર્ષ તેને પાંજરાની
આદત આપવામાં આવે તો પછી પાંજરા-
માંથી ઘરાર નીકળવાનું તેને મન નહિ
થાય. તમે પણ પક્ષીની ભિસાલ છો.

જ્યારે તમે પહેલાં પાંજરામાં આવ્યા
ત્યારે તમારે જ્યાલ હુતો કે ભાગી જઈએ
પણ પછી પાંજરાની આદત પડી, તની
અંદરના ઝોરાકથી ખુશી થયા. હુવામાં
કુરવા ખુશી નથી. પુત્ર, કુટુંબ તેના
કુટુંબ, તેના પુત્ર, તેમાં તમે એવા ઈસાયા
છો, એવા લોભાયા છો કે, કાપેલી
પાંખવાળા પક્ષીની પેઠે પાંખ કાપેલા થયા.

હુવે તમે કયાં જાઓ ? !

કોઈ ખુલખુલ ઘણ્ણા વેગથી ઉડનારી
હોય, તને સેનાના પાંજરામાં રાખી, સારા
સારા મેવા, પાણી વિગેરે આપવામાં આવે,
તો પણ તને એવું દિલ થશે કે, ઉદ્દી
જઉં; પણ આસ્તે આસ્તે તેની પાંખો
કાપી નાંખવામાં આવે, તેના ઘર્યાં એકઠા
થતાં જાય, તો પચાસ વર્ષ ખાદ તેમને
ખહુર કાઢતાં, તેઓ ઉદ્દી નહિ શકે;
કારણ કે, કેદખાનામાં તેમનો જત્તમ થયો
છે. હુવામાં ફરવાની અથવા ઉડવાની
ખુખીઓથી તેઓ અણાણુ છે.

તમે પણ બેખુદ છો. તમારા દીનની

અસલ ખુખી તમે જાળતા નથી, તેની
માયના સમજતા નથી. દીનની કેવી ઉમેદ
� તે વિષે તમને ઘર્યર નથી.

તમારામાં ઘણુંએક હેવા છ કે
એઓએ પોતાના નામો ઈસમાઈલી મગ-
હુયમાં રાખેલા છે અને કહે છ કે અમે
ઇસમાઈલી છીએ; પણ ઇસમાઈલી મગ-
હુય શું છ અને તેની ખુખી શું છ તે
વિષે તઓને કાંઈ ઘર્યર નથી. તેઓ
નાદાન છે.

તમે પણ આસ્તે આસ્તે ચુઝીમાં દિલ
લગાડો. એનાથી પણ ઉપર જવાનો જ્યાલ

રાખો. સુકી મજૂહું એ તરીકત છે, પણ
હુકીકતમાં પહોંચરો. તમે આસ્તે આસ્તે
ઉડવા લાગરો. દિદમવાળો રહુ પગથિયું
પગથિયું ઉંચે ચડરો. તે એક દાદર પુરે
કરી ખીંબ દાદર પર ચડી શકરો.

પણ જેને દિદમ નથી તે કહે છે કે હું
તો કયાંય જતો નથી, અહીંયાજ ઘેડો છું.
આવા ભાણુસના ઘટમાં અમારા કુરમાન
ઘડ ઘેસતા નથી. જે સમજ શકતો નથી,
તેના ઘટમાં કેમ ઘડ ઘેશો? અને તે કેમ
ધૂતઘાર લાવે? અમારા કુરમાન જેએ
સમજ શકશો તેમને મીઠારા લાગરો.

અમારા કુરમાન પ્રમાણે નહિ ચાલરો।

તો, તમે પરેશાન થશો॥ ત્યાં લોખડ તથા
આતશાના ગુરુંજ તમારા માથામાં મારવામાં
આવશો, ત્યારે તમે ત્યાં પોકાર કરશો અને
કહેશો કે, “તૌઘા તૌઘા” રાત દિવસ
ગુરુંજ માથામાં લાગશો. એ ઘણીનો
ગુરુંજ ઘણો ઇન્ન પહેંચાડનાર છે.
આતશાના ગુરુંજથી ડરીને ધાસ્તીના લીધે
છુઘાંત ઘંફળી કરે, તે મોમન નથી; પણ
ઘરું કરવું એ છે કે, ખુદાના દીદારથી કુર
ન થવાય, તેનાથી કરવું જોઈએ.

નેમ હુઝરત મુર્ત્જાગ્નિએ એક
દિવસ, નમાઝની વખતે ફરમાવ્યું કે,
“ખુદાયા મને ઘણેશ્તની તમા નથી, તેમ

હું દોઝખથી કરતો નથી, જે દુઃખ હેઠાં
હોય તે મને હે, ભારાથી સારાઈ કર. હું
તારે આરાક છું.” હુકીકત એ છે.

મુત્તુઅલ્લી મોળુઝા કરતા હતા,
પરંતુ મોળુઝા માણુસ પણ શીઘે છે
અને જાદુગરે ઘનાવી રાકે છે. મુત્તુઅલ્લીનો મોળુઝો એ હતો કે, પોતાની
જગ્યા પર પહોંચાડે. હુકીકતના અસલ
મકાને પહોંચો.

જે તમારે પુછું હોય તે પુછો કે,
ફલાણું બાધ્યત અમે સમજ રાકતા નથી.
તમે બેઘ્યર છો. જેઓ બેઘ્યર છે તે
કેવા કેવા જ્યાલ કરે છે કે, જે બિમાર હોય

તને તની બિમારીમાંથી સાહેખ સારા કરે
છે, એ અમારું કામ નથી. અમારું કામ
એ છે કે તમને સીધો અને સાચો રસ્તો
દેખાડીએ જેથી, તમે પાર પામી શકો
અને તે જગ્યાએ પહોંચો. તમે ઝના
કિલાહુ થાએ.

ઝના - કંઈ નહિ.

કિ - અંદર.

અદલાહુ - ખુદા.

ઝના કિલાહુ - ખુદાવંદતાલાની
બાતમાં નાખુદ થઇ જગ્યું.

તમે એવા ખ્યાલ કરો કે 'ભલા !
 ખુદા કોણું છે ? અને ખુદામાં કેમ ન
 સમાઉં ? ! ' એવી ઉમેદ રાખો.
 તમે એવા ખ્યાલ નહિ રાખો. કે
 અમોએ ઝરમાન વ્યથ્ય કર્યો છે. અમારા
 જેમ કે હાજરત ઈસા ખુદામાં ઝના
 થયા હતા.

હાજરત ઈસા કોણું હતા ? હાજરત ઈસા
 હુકીકતી હતા, તે ખુદામાં ઝના થયા.
 હાજરત રસુલ કરીમની મેઘરાજ વિષે
 તમોએ સાંભળ્યું છે. એ ઘાઘતમાં તમોએ
 શું ખ્યાલ કર્યો ? માણસો કહે છે કે,

હારત રસુલ ધોડા ઉપર બેસી મેમ્પરાજ
સિધાંયા, એ ઘધી લોકોની વાતો છે.
ખુદા માત્ર આસમાનમાંજ છે, એમ નથી,
ખુદા ઘધે ઠૈકાણે છે; પણ તેઓ અસલ
મકાને પહોંચી પાછા વહ્યા તે રાતં
મેમ્પરાજની હુતી, આ મેમ્પરાજ છે.

તમે એની માયના સમજતા નથી.
પેગાઘરે જે ભિસાલો કરમાવેલી છે તેની
માયના અકુલવાળા દાના હોય તે સમજે.
પણ જે બેમ્પકુલ હોય, તે કહેશે કે
કિસ્સા કહુણ્ણીએ ખરી છે. અકુલવાળો
માણુસ કહેશે કે, ધન્સાન એ એક મેટી
ચીજ છે. સારા નરસાને ઘરાઘર એણએ

તે ઈંસાન છે. અક્ષલવાળો. જવાયુ આપશે
કે એ એક મિસાલ છે. એની પુલના
કરીને સમન્ને, એ તમારા હુથમાં છે.
એવો વિચાર નહિ કરતાં કે કામ ધણ
મુશ્કીલ છે.

એવું નથી કે ભાત્ર ભુર્તાંબલીની
ઓલાદ ત્યાં પહોંચે. જે કોઈ પક્ષીની
માર્ક ઉડે, નિશ્ચય કરે તે પહોંચે. પહેલાં
આજું ન ઉડાય તો થોડું ઉડે. એમ કરતાં
કરતાં અસલ ઘાડું જેવો થશે અને
ઘરાયર ઉડશે. આ સર્વે ઘાયત્રે ઘાલ
કરે. આમાં પક્ષીની કંઈપણ મકસદ
નથી. જે પક્ષીની મકસદ હોત તો, એ

તમને કહેતે નહિં.

દીન એ છે કે, ખોટા જ્યાલ નહિં
 કરવા. ખુદાએ તમને પેદા કીધાં છે. તમે
 ખુદાને સિજદો કરો તેમાં ખુદાને શું
 ઝાયદો? ખુદા ઝકત એકમાં નથી. ખુદા
 સર્વો ઠૈકાળે છે. તને ખુશી કરવો એ
 ઘહેતર છે. જ્યારે તમારું હિલ રાજ
 રહે, ત્યારે ખુદા રાજ રહે.

તમે દુનિયામાં કેદમાં છો ત્યાં સુધી
 રાજ નહિં થશો. પોતાના પ્રાણુનો ઘાત
 કરીને કેદમાંથી નીકળી જવું એમ નથી;
 મુચ્ચા તો વળી મેટ્ટું કેદખાનું આગળ છે;

એકમાંથી ખીજું, ત્રીજું વિગેરે, પોતાના
પ્રાણનો ઘાત કરીને છુટવું એમાં શું
કાયદો છે?

તમને ખ્યર નથી કે તમારા વડવા
કેવા હુતા?

અગાઉના જમાનામાં ઉભર ખૈયામ
એક સુન્ની માણસ શારીઅતી કાજી હુતો.
તેના હુથમાં કિતાખ હુતી. હુથ પગ
ધોવાની નકામી વાતો કરતો હુતો.
ત્યારખાદ તેણે આસ્તે આસ્તે ખુદાના દિદમ
વિષે ખયાલ કીધો. પછી નાસર ખુશર્દ
સાથે તેની દોસ્તી થઈ. નાસર ખુશર્દની
દોસ્તી થયા પછી, ઉભર ખૈયામ આસ્તે

આસ્તે મહેનત લઈને પોતાને દરજાએ
પહોંચ્યો. તે હું મેશા હૈયાત છું. તે
પોતાની કિતાખમાં લખી ગયો છે કે હું
હું મેશા જીવતો છું.

ઘંઢગીનો શું અર્થ છે?

ઘંદ - દીત્સાનના પગ ઘાંધ્યા હોય તે.

અઘંદ - ગુલામ.

અઘંદલાહુ - ખુદાનો ગુલામ.

તમારો ગુલામ હોય તે ઘણ્ણા વર્ષ
તમારી બિદભત ઘરાઘર કરે, તો શું તમે
તને આજ્ઞાદ નહિ કરશો? તમારો કોઈ
ગુલામ હોય અને તે સારો ભાણુસ હોય

અને હું મેરા તમારી ઘિદ્ધમત કરતો હોય,
તો તમે તેના માટે શું કરશો? તેને પૈસા
આપશો તો તે રાજ નહિ થશે. તેને
આજાએ કરશો, ત્યારેજ તે ખુશી થશે.

તમે ઘણેખુદા છો. ખુદા રહેભુર રાહેભીન
છો. ત્યારે શું તમને કોઈ વખત આજાએ
નહિ કરે? અમે નથી કહેતા કે આ દુનિયા
પછી પણું તે આજાદીમાં તમે પહોંચી
શકશો. એ સર્વે સીધા રસ્તા ઉપર ચાલવા
તથા આલા હિંમત ઉપર આધાર રાખે છો.
એ સધળું તમારા હુથમાંજ છો.

તમે જ્યાલ કરો કે તમારો દીન શું
છો? તમારા દીનનું ફરમાન છો કે તમે

જેઠ વિચારીને ચાલો અને જ્યાલ કરી
 જુએ. દાખલા તરીકે તમે જગતમાં
 ચાલો છો, ત્યાં ત્રણ ચાર ટૈકાણે પાણીના
 ઘાયેચિયા છે, તેમાં પાણી લરેલું છે,
 મગરય વખતે જ્યારે સુરજ અસ્ત થાય
 છે ત્યારે, સુરજના નુરનો પ્રકાશ પાણી
 ઉપર પડે છે. જે તે જગતમાં જનાર
 દિન્સાન એ અક્ષલ હુશે તો કહેશે કે આ
 નુરાની રંગ પાણીનો છે. પણ જે તે
 માણુસ અક્ષલવાળો હુશે તો તે કહેશે કે
 આ પાણીનો રંગ નથી, એ સુરજનું નુર
 છે. મેં એ પાણી દીકેલું છે. અગાઉનો
 તથા હમણાનો પાણીનો રંગ સરખો નથી.

આ તો સુરજનું જુર પાણી ઉપર પડેલ છે.
જ્યારે સુરજ અર્થત થઇ જશે ત્યારે ભાલમ
પડશે કે તે સુરજનું જુર હતું.

જ્યારે આ અથવા પહુંચ ઉપર
વીજળી પડે છે, ત્યારે તમે કહેશો કે એ
વીજળી કુંગર છે. એ બેધદમી તથા
નાદાનની વાતો છે.

તમે પોતે ખુદાનો દરજનો સમજો અને
હુકીકતના રસ્તાથી વાકેઝગાર થાઓ, ત્યારે
તમે આજાદ થશો. ખુદાનો દરજનો
સમજ્યા અગાઉ પોતાનો દરજનો
સમજો. ત્યારખાદ ખુદાના દરજનની
ખખર પડશો.

ઇન્સાન રાત દ્વિસ પૈસા પેદા કરે,
 સારા કામ કરે પછી ભરી જાય, ત્યારે શું
 કાયદો? તેમજ હું મેશા ઘંઢગી કરવા છતાં
 આજાંદીમાં ન પહોંચે તો શું વહું?
 અક્કલવાળો થોડાથી નારાજ થશો.

તમારી પાસે ગુલામ હોય, તેને વાંકી
 ટાપી પહેરાવો તથા પીળો લેખાસ ઘનાવી
 આપો, પણ જો તે ગુલામ અક્કલવાળો
 હુશો તો તેને ગમ થશો અને કહેશો કે હું
 નારાજ છું. તેને શું થવું જોઈએ? તેને
 ઘટારત છે કે આગ્રાદ થાય. અને શોઠ ઘને.
 ત્યારેજ અક્કલવાળો રાજ થાય. જો તે
 ગુલામ બેઅક્કલ હુશો, તો કહેશો કે હું

ગુલામ છું, સારી ખાવાનું, સારા કપડા
તથા વાપરવાનું સર્વે સુખ છે. જે મારે
ધણી મને આજ્ઞાદ કરી નાખશે તો મારે
મહેનત કરવી પડશે અને હું જુઘે મરી
જદ્દિશા, મને ગુલામી ઘણેતર છે. સધળા
ઇન્સાનનું આ પ્રમાણે છે.

અમારા ફરમાન તમારા દિલમાં ઘડ
એસે છે કે નહિ? અમે મુશકીલ સમજુએ
છીએ; સયાય એ છે કે, અમે ખીજ
ખ્યાલમાં કહુએ છીએ અને તમે ખીજ
ખ્યાલમાં સમજો છો.

તમે ઇસમાધલી દીનની ભાયના નથી
સમજતા. તમે સહી ચોકુસ કરીને સમજો

કે, તમારો દરજો કેવો છે ?

જે ધૃતસાનનો પહેરવેશ ખરાય અને
મલો હોય, તેના લેખાશ ઉપર રસ્તામાં
થાડી મારી તથા ચીકલ પડે તો તેને
આઝ્સેસ નહિ થાય. તેના કપડાં પહેલાંથીજ
મલા હુતા, તેના ઉપર થાડા વધુ ડાઢા
થવાથી તેને આઝ્સેસ થશે નહિ; પણ જે
ધૃતસાનનાં લુગડાં ધોખી ધોખેલા સ્વર્ઘ
હુશે, તેને રસ્તે જતાં ગાડીનો થોડો ચીકલ
લુગડા ઉપર લાગી જય, તો તેને કચવાળું
લાગશે, કારણું કે તેના લેખાસ હુંમેશાં
સારું રહે છે. તે કહેશે કે જલદી ઘરે
જાઉં અને આ લેખાસ ખંદલી નાખું,

જેથી ભારા હોસ્ટે ભારી મરકરી ન કરે.
 તે ઘેર જઈ ખીજ લુગડાં પહેરી લેશે.
 આની ભાયના સમને છે? ચીકલ છે
 તે ગુન્હા છે. એ ચીકલ આ છે કે:
 (૧) પરાયો ભાલ ખાઈ જવો. (૨) પરાઈ
 ઓરત પર ઘદનજર કરવી. (૩) મરહાનો
 ખ્યાલ પારકી સ્ત્રો ઉપર હોય. (૪) ફલા-
 ણાના સો ઝિયા ભારા ઝિયા સાથે છે,
 તે ખાઈ જઉં. આ સધળા ગુન્હા ચીકલ
 છે. મોભીન ઈન્સાન લેખાસ સારો પહેરે
 છે. તે થોડા ગુન્હા કરે તો પણ તેની
 નજરમાં તે ગુન્હા મોટા જણાય છે. તે
 જલદી ખીજે પહેરવેશ પહેરી લેશે.

દેસ્તા માશુકને ભળવાની ઉમેદ રાખતો
હોય અને તેનો લેખાસ ઘરાય હોય,
તો માશુક તેને કંખુલ નહિ કરે, કહેશે કે
જાઓ જાઓ.

તે માશુક કોણ છે? તે માશુક
ખુદાવંદતાલા છે. ઘરાય લેખાસ તે
ગુનહુા છે, રાત દિવસ ચીકલમાં લેટે, તે
ગુલામ છે. તે કદી આજાદીની તલઘ
રાખતો નથી. આ જે સધળા ફરમાન
થાય છે, તે તમે સમજો. હુકીકત અને
શરિયત શું છે? આ ખીલ સોઘત છે
“આ” અને “તે” ક્યારે પણ એક
થવાના નથી. ક્યારે પણ એક નહિ થશે.

“આ” કિતાખ, રોજા, નમાજુ તથા
અંદુંગિને ચાહે છે. “તે” ઉમેહ આજ્ઞા-
દીની રાખે છે. એ એ વાતો છે.
ઘરના વિચારે જુદા જુદા છે. અમારા
વાસ્તે ઘણી મહેનત છે.

“એ” એધદમી કેમ રાજ થાય?

“એ” હુકીકતને પકડતો નથી. એને
હુકીકત લેધતી નથી. જેએ એધદમ છે
તેએ હુકીકતને છાડી આપે છે, પણ
જે હુકીકતી છે તે ખીજે રહ્યે રહ્યે ચાલે
છે. જેમ આગળ (૧) ઈસા (૨) પીર
સદરદીન (૩) નાસર ખુશર (૪) પીર

રામસ (૫) મૌલાના ઇભી, એવી રીતના
માણસો હુકીકતના રસ્તા ઉપર ચાલ્યા.
આ રસ્તો નાદાનને માટે ઘડુ મુરુકીલ છે.

અમે જેધાએ છીએ કે અમારા
દીનમાંથી ફરી જઈને કેદ ધર્સનાયશરી
અથવા સુન્ની તથા નસારા થઈ જાય છે,
તેમાં અમે અજઘ થતા નથી, કારણુ કે
તે પોતે એદિદમ છે. એઅકુલ આદમ માટે
હુકીકતી દીન ઘણોઝ મુરુકીલ છે.
એઅકુલને માટે અમારે દીન ઘણોઝ
મુરુકીલ છે. એઅકુલ ફરી જાય તેમાં
અમને તાળુખી લાગતી નથી, કેમકે આ
દીન ઘણોઝ સખત છે.

૬૬

ને દીતસાન અકુલનો અધ્યક્ષ છે તે
ખરાય છે. તે હુરામની પછવાડે ઢોડે છે,
પણ ને દાના અકુલવાળો હુરો તે કહેશે
કે આ રસ્તો સારો છે. તે તેનો વિચાર
કરીને ચાહશે. અકુલવાળો કહેશે કે મારી
આરજુ આજાદીની છે. હું આજાદી
પછવાડે ઢોડું જું, હું ઢોડીશા, હું શોધીશા !

તમે જ્યારે સિજદો કરો ત્યારે માંગો
(ખુદાયા) ‘અમને અસલ ભક્તાને પહોંચાડ.
નેમ ખાળક પોતાની માતાથી જુદું પડે છે,
ઘોવાઈ ગયું હોય છે ત્યારે તે રડે છે કે
ક્યારે મા પાસે જઈ પહોંચું !’ તમે પણ
તેવા થાએ.

અમેાએ તમને ધણા ફરમાન કર્યા
 પણ ફાયદા ત્યારેજ થાય કે જ્યારે અમારા
 ફરમાન પ્રમાણે ચાલો. જે તમે અમારા
 ફરમાન પ્રમાણે અમલ કરો તો જાણે
 અમે સવાર સુધી ફરમાન કીધાં એમ
 અમે સમજશું.

ઇન્દ્રાઓ, તમારામાં કેટલાક હુકીકતી
 છે, તેઓને અમારા ફરમાન ધણાજ
 ફાયદા કરશો, તેઓના દિલમાં થડ ઐસી
 જરો; પણ જેઓના દિલ ઊંઝું છે અને
 હિંમત નથી તેમના દિલમાં થાડો અથવા
 વધારે શાક ઉપન થશો, કારણું કે હુકીકત
 ઉપર તેમને એછા ઇતખાર છે. તે અમે

સથળું સમજ્ઞાએ છીએ. સથળાના દિલ્લી
અમને ખખર છે.

શરિયતીએ અમારા હકીકતી ઝરમાન
સાંભળે તો તેમના દિલમાં અસર ફરતા
નથી. જેએ હકીકતી નથી તેએ
ખેઅકુલ છે.

ઇન્સાનને જેશ ઉપનન થાય છે તે
ખોટો જેશ છે. તેને પણ ઝરમાન અસર
કરતાં નથી. તેએને એમ થરો કે જેમ
પાણીને આતશ ઉપર રાખવાથી હુવા
થઇને ઉડી જાય છે, તે આતશ ઉપર
જેશમાં ઉકળે છે અને અવાજ ફરે છે;
દિલનો જેશ પણ પાણી માર્ક છે.

અમે અમારા દિલથી તમને દુઅા
 કરીયે છીએ કે, ‘ખુદાયા ! તેમના દિલમાં
 એવી તાકાત ઘક્ષ કે આજાં થાય,
 હુકીકતી થાય અને ઘરાખીથી દુર ભાગો.
 તેઓ સીધે રસ્તે ચાલે અને રસ્તો સવાગો
 પકડે. ખુદાયા ! તેઓને હુકીકતી આંખો
 ઘક્ષ !’ આ દુઅા સંઘળી દુઅા કરતાં
 વધારે છે.

ઇતિશાયદલાહુ, અમારા ફરમાન હુમેશાં
 દિલમાં રાખજો, જુલી નહિ જશો. એમ
 ન ઘને કે જ્યાં સુધી અમે જાહેરીનાં
 અત્રે હુઅર છીએ ત્યાં સુધી અમારા
 ફરમાન વાંચો અને પછી ન વાંચો એમ

ન થવું જોઈએ. જેમ ગીતાન વાંચો.
 છો તેમ અમારા ફરમાન વાંચ્યાનો. જેમ
 ગીતાનની માયના કાઢો છો તેમ અમારા
 ફરમાનની પણ માયના કાઢનો. અમારા
 ફરમાન એજ ગીતાન છે. અમારા
 સિધાવ્યા ખાદ એવું નહિએ
 સમજતા કે સાહેય સિધાવી ગયા. જેમ
 તમે ઈમામને હુઅર સમજો છો, તેમ હુઅર
 સમજનો. હુઅર ઈમામ બાહેરીમાં હુંમેશાં
 હુઅર નથી બેસી રહેતા, પણ તેઓને
 હુઅર સમજવા જોઈએ. અમે પણ હુંમેશાં
 તમારી પાસે પોડા છીએ.

